

## અનુક્રમણિકા

પ્રકરણ	વિષય	પાના નંબર
	પ્રસ્તાવના	૧
૧	વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગતો.	૨-૪
૨	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો	૫-૮
૩	દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહીત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી.	૯
૪	પોતાના કાર્યો બજાવવા માટે પોતે નકદી કરેલા ધોરણો.	૯
૫	પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.	૯
૬	પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક.	૯
૭	તેની નિતિ અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સત્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજૂઆત માટેની વિધમાન કોઈ ગોઠવણાની વિગતો.	૯
૮	તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ, કાઉન્સિલરો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્ય નોંધ લોકોને મળવા પાત્ર છે કે કેમ ?	૧૦
૯	તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહીતી પુસ્તીકા.	૧૦
૧૦	તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.	૧૧
૧૧	તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતું તેની દરેક એજન્સીઓ ફાળવેલ અંદાજ પત્ર.	૧૧
૧૨	ફાળવેલ રકમો, અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહીત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજાવણીની રીત.	૧૨
૧૩	તેણે આપેલ છૂટ છાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.	૧૨
૧૪	ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહીતીને લગતી વિગતો.	૧૨
૧૫	જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહીતની માહીતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.	૧૨
૧૬	જાહેર માહીતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો.	૧૩-૧૪
૧૭	ઠરાવવામાં આવે તેવી બીજી માહીતી.	૧૪

## વિજીલન્સ ખાતુ

### અમદાવાદ મ્યુનિસિપલ કોરોરિશન

### માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ -૨૦૦૫

માહિતી પુસ્તીકા

( સને. ૨૦૨૨-૨૩)

અધતન કર્યા તારીખ : ૦૧.૦૫.૨૦૨૨ ની સ્થિતિએ

વિજીલન્સ ખાતુ

અમદાવાદ મ્યુનિસિપલ કોરોરિશન,  
૧લો માળ , “ સી ” બ્લોક , સરદાર પટેલ ભવન,  
દાણાપીઠ , અમદાવાદ-૩૮૦ ૦૦૧  
ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૮૯૮૧૧.

## પ્રસ્તાવના :-

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિજ્ઞલન્સ ખાતાને જાહેર સંગઠન તરીકે જાહેર કરવામાં આવેલ છે. વિજ્ઞલન્સ ખાતાની કામગીરી, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વહીવટતંત્ર માં તેનું સ્થાન, ફરજી અને જવાબદારીઓ અંગે જાહેર જનતાને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિજ્ઞલન્સ ખાતાના કાર્યક્ષેત્ર અંગે સામાન્ય પ્રજામાં સાચી સમજ પ્રવર્તે તથા આ પ્રકારની રજૂઆત કરી શકાય તે અંગેની વ્યાપક માહિતી ઉપલબ્ધ થાય તેમજ વિજ્ઞલન્સ ખાતાના કાર્યક્ષેત્રની કામગીરી વધુ સરળ, વ્યાપક તેમજ લોકાભિમુખ બને તે હેતુસર આ પુસ્તીકા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સાથે જેમને રોજ- બરોજની કામગીરી રહેતી હોય તેવા તમામ નાગરીકોને તેઓની કામગીરી સરળ અને ઝડપી બને તેમજ જાહેર સેવક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રી અને કર્મચારીઓને લાગુ પડતા વર્તણૂક ( શિસ્ત અને અપીલ ) નિયમો સબંધમાં તેઓની જવાબદારી અને ફરજ પ્રત્યે વ્યાપક સમજ પ્રવર્તે તે હેતુથી આ પુસ્તિકા પ્રકાશન કરવામાં આવેછે.

વિજ્ઞલન્સ ખાતાની કામગીરી અંગેની સંપૂર્ણ વિગતો આ પુસ્તીકામાં આપવામાં આવેલ છે. તેમ છતાં વિજ્ઞલન્સ ખાતાની કામગીરી અંગે વધુ માહિતી આવશ્યક હોયતો નીચે જાણાવેલ અધિકારીશ્રીઓનો સંપર્ક કરવો

૧. શ્રી હેમલબેન બી. ભાવસાર

જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજ્ઞ.જનરલ.)

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,

સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,

દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૪,

૨ શ્રી પ્રફુલ્લભાઈ બી.ભરવાડ

જાહેર માહિતી અધિકારી અને આસી.સી.ટી.એન્઱્ચ. (ટેકનીકલ)

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,

સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,

દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૪૨૮

૩ શ્રી ભીખાભાઈ એચ. પટેલ

જાહેર માહિતી અધિકારી અને આસી.એ.ઓ./આસી.ટી.ડી.ઓ. (એસ્ટેટ/ટી.ડી.ઓ.)

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,

સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,

દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૧

૪ શ્રી હીના એસ. ભાથાવાલા

અપીલ અધિકારી અને ડાયરેક્ટર/ હેડ ઓફ ટીપાર્ટમેન્ટ (વિજ્ઞલન્સ),

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,

સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,

દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૮૯૮૮/૬૪૮

- ૫ શ્રી નૈનેશ બી. દોશી  
 અપીલ અધિકારી અને એડી.સીટી.ઇજનેર (વિજ્ઞલન્સ ટેકનીકલ),  
 અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
 સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
 દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
 ટે.નં. ૨૫૩૮૯૮૮/૪૨૯
- ૬ શ્રી હિતેષ્ખુમાર એન. ગજજર  
 અપીલ અધિકારી અને આસી.મ્યુ.કમિશનર (વિજ્ઞલન્સ એસ્ટેટ/ટી.ડી.ઓ.),  
 અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
 સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
 દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
 ટે.નં. ૨૫૩૮૯૮૮/૪૨૯

વધુમાં આ પુસ્તીકામાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતી મેળવવા માટે વિજ્ઞલન્સ ખાતાના જાહેર માહિતી અધિકારીશ્રીને લેખિત અરજી કરી તે અંગેની રાજ્ય સરકારે મુકરર કરેલી ફી ચુકવી નિયત સમય મર્યાદામાં અરજદાર જરૂરી માહિતી પોતાના દશાવિલ સરનામે મેળવી શકે છે. જો આ માહિતી સક્ષમ સત્તાને જાહેરહીતમાં આપવી યોગ્ય નહીં જણાયતો તે અંગેની અરજદારશ્રીને લેખીતમાં જાણ કરવામાં આવશે.

## **૧. વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજો :-**

અમદાવાદ મુનિ.કોપોરિશનનાં તમામ ખાતાઓની નિયમિતતા બાબતની દેખરેખ, અમદાવાદ મુનિ. કોપોરિશનના તમામ વહીવટી તથા ટેકનીકલ ખાતાઓના અધિકારી/કર્મચારીઓ વિરુધ્ય આવેલ ભણ્ણાચાર અને ગેરરીતીઓને લગતી ફરિયાદોની તપાસ કરી યોગ્ય નિકાલ કરવાની, તથા મુનિ.કોપોરિશનના વિવિધ ખાતાઓનાં કર્મચારીઓનું હાજરી ચેકીંગ કરી, ખાતાઓને કાર્યક્ષમ રાખવાની કામગીરી મુનિ. કમિશનરશ્રી ની સીધી દેખરેખ તથા રાહબરી હેઠળ વિજિલન્સ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- મુનિસિપલ અધિકારી/કર્મચારીએ અયોગ્ય હેતુ કે લાંચ, ભણ્ણાચાર, ગેરરીતી આચરી કોઈ કામ કે વ્યવહાર કર્યાનો કોઈ આક્ષેપ હોય તો તપાસ કરી શકેછે.
- મુનિસિપલ અધિકારી/કર્મચારીશ્રીએ અયોગ્ય હેતુ કે લાંચરૂશત, ભણ્ણાચાર, ગેરવર્તણૂક અને ગેરરીતી કરી હોય અથવા તો આવા હેતુસર પોતાની સત્તાનો દુર ઉપયોગ કરેલ હોય, તો તેવી મળેલ ફરીયાદ બાબતે તપાસ કરી શકેછે.
- મુનિસિપલ કોપોરિશનના ખાતાઓની વહીવટી કાર્યપદ્ધતિ અને પ્રણાલી પ્રથાઓની સમીક્ષા કરી શકે છે.
- વિજિલન્સ ખાતાની કામગીરી (૧) જનરલ (૨) ટેકનીકલ (૩) એસ્ટેટ / ટી.ડી.ઓ. વિભાગ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે.

## **(અ) જનરલ વિભાગ :-**

- અમદાવાદ મુનિ.કોપોર્ના રેવન્યુ તથા નોન રેવન્યુ મળી ૪૫ જેટલા જુદા જુદા ખાતાઓ તથા શેઠ વા.સા.જનરલ હોસ્પીટલ, શેઠ લ.ગો. મુનિસિપલ જનરલ હોસ્પીટલ, શ્રીમતિ શા.ચી.લા. મુનિસિપલ જનરલ હોસ્પીટલ, શ્રી ચી.હ.નગરી મુનિસિપલ આંખની હોસ્પીટલ, ટી.બી.હોસ્પીટલ, દવાખાનાઓ, મસુતિગૃહો, રેફરલ હોસ્પીટલો તેમજ એન.એચ.એલ. મુનિસિપલ મેડીકલ કોલેજ, સ્વર્ણિમ તેન્ટલ કોલેજ દ્વારા અપાતી સેવાઓ બાબતે શહેરી નાગરીકો, સરકારી-બિન સરકારી સંસ્થાઓ, રાજકીય પદાધિકારીઓ તેમજ મુનિ.કોપોર્ના ઉચ્ચ અધિકારીઓ તરફથી આવતી ફરીયાદોનો નિકાલ વિજિલન્સ ખાતાના જનરલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- વિજિલન્સ ખાતાના જનરલ વિભાગને લગતી પ્રાથમિક તપાસની કામગીરી માટે ૦૧-૩.ડાયરેક્ટર, ૦૨-આસી.મેનેજર, ૦૪- વિજિલન્સ ઓફીસર (જનરલ) અને ૧૪ આસી. વિજિલન્સ ઓફીસર મળી કુલ-૨૦ અધિકારીઓની જગ્યાઓ મંજુર થયેલ છે.

(૧) ડાયરેક્ટર/ એચ.ઓ.ડી. દ્વારા થતી કામગીરીઓ :-

- વિજ્ઞલન્સ ખાતાની તમામ વહીવટી કામગીરી
- વર્ગ-૦૧, ૨ ના અધિકારીઓને N.O.C.આપવાની કામગીરી.
- વિજ્ઞલન્સ ખાતાના જનરલ વિભાગ, અને ઈલેક્ટ્રીકલ એન્ડ મીકેનીકલ વિભાગ તેમજ ઈજનેરના અધિકારીઓ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા ડેફરેખ રાખવાની કામગીરી.
- વિજ્ઞલન્સ ખાતાના જનરલ વિભાગના આસી.મેનેજરો, વિજ્ઞલન્સ ઓફિસરો અને આસી. વિજ્ઞલન્સ ઓફિસરોને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મુકવાની કામગીરી.

(૨) આસી.મેનેજર (જન.૦૧) અને આસી.મેનેજર (જન.૦૨) દ્વારા થતી કામગીરીઓ :-

- ખુનિ.કોર્પો.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ કોન્ઝરવન્સી સર્વિસીસ વિભાગ, પાર્કસ એન્ડ ગાર્ડન, સેન્ટ્રલ રેકર્ડ તથા ટેન્ડર ઓફિસ, સેન્ટ્રલ વર્કશૉપ, સેન્ટ્રલ સ્ટોર્સ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ, ખુનિ.હોસ્પીટલો (તમામ) પ્રસુતિગૃહો/દવાખાના, કુંબ કલ્યાણ/આર.સી.એચ. સેવાઓ, ફાયર બ્રીગેડ, સ્નાનાગાર, ખુજિયમ, કંકરીયા લેક, જુ, બાલવાટીકા, એમ.જે.લાયબ્રેરી, સી.એન.સી.ડી., સ્લોટર હાઉસ, જન્મ મરણ, મેલેરીયા, ખુનિ.મેડીકલ કોલેજો, હેલ્થ, એ.એમ.ટી.એસ; સેન્ટ્રલ ઓફિસ, સેન્ટ્રલ લેબોરેટરી, ઈ-ગર્વનન્સ (સ્લિવીક સેન્ટરો) અને એકાઉન્ટ ખાતા વિરુધ્ય આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી
  - ઈલેક્ટ્રીકલ એન્ડ મીકેનીકલ, પાવર પ્લાન્ટ, વોટર ઓપરેશન જેવા ખાતાઓમાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુધ્ય આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
  - ખુનિ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓમાં ફરજ બજાવતા વર્ગ-૨ ના અધિકારીઓ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની બઢતી અને નિવૃત્તિ વખતે તથા પાસપોર્ટ કલાવવા માટે વિજ્ઞલન્સ ખાતાની એન.ઓ.સી આપવા અંગેની કામગીરી.
  - ખુનિ.કોર્પો.ના વહીકલ ટેક્ષ, યુ.સી.ડી.મધ્યાહન ભોજન યોજના, ઈલેક્શન, બાલભવન, પુસ્તકાલય, વ્યાયામ વિધાલય, પ.વ.એકાઉન્ટ, પ્રોપર્ટી ટેક્ષ, ઈ.શી; આઈ.આર; લીગલ, પબ્લિસીટી, સ્કૂલબોર્ડ, માધ્યમિક શાળાઓ, પ્રોફેશનલ ટેક્ષ, ગુમાસ્તાધારા, ઓડીટ, સેકેટરી અને પ્લાનીગ ખાતા વિરુધ્યની ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
  - એસ.ટી.પી. અને એસ્ટેટ-ટી.ડી.ઓ.ખાતામાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુધ્ય આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
- 
- આસી.મેનેજર (વિજ્ઞલન્સ જનરલ - ૦૧) ની જગ્યા હાલમાં ખાલી છે.

## (બ) ટેકનીકલ વિભાગ :-

વિજ્ઞલન્સ ખાતાના ટેકનીકલ વિભાગની કામગીરી ત્રણ પેટા વિભાગમાં વહેચાયેલ છે. (૧) એન્ઝનીયરીગ વિભાગ (૨) એસ્ટેટ-ટી.ડી.ઓ. વિભાગ (૩) ઇલેક્ટ્રોકલ એન્ડ મીકેનીકલ વિભાગ.

### ૧. એન્ઝનીયરીગ વિભાગ :-

- ભ્યુનિ.કોપોરેશનના ૦૭ જોન દ્વારા થતી ટેકનીકલ કામગીરી તથા જુદા જુદા પ્રોજેક્ટોની ટેકનીકલ કામગીરીની દેખરેખ રાખવા તેમજ આ કામગીરી સંદર્ભે આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં ૦૧ ઉઘ્યુટી સીટી એન્ઝનીયર તથા આસી.સી.ટી.એન્ઝ. (ટેકનીકલ)ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ડાયરેક્ટર વિજ્ઞલન્સ મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષ્ણયાર્થે મૂકવામાં આવે છે.

### ૨. ઇલેક્ટ્રોકલ એન્ડ મીકેનીકલ વિભાગ :-

- આ વિભાગના વિજ્ઞલન્સ ઓફિસર (ઇ એન્ડ એમ)ની જગ્યા હાલમાં ખાલી છે.
- આ વિભાગમાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુદ્ધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસની કામગીરી આસી.મેનેજર (જન.૦૨) દ્વારા કરવામાં આવે છે તથા પ્રાથમિક તપાસના રીપોર્ટ ડાયરેક્ટર વિજ્ઞલન્સ મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષ્ણયાર્થે મૂકવામાં આવે છે.

## (ક) એસ્ટેટ/ ટી.ડી.ઓ.વિભાગ :-

### આસી.ભ્યુનિ.કમિશનર(વિજ્ઞલન્સ) દ્વારા થતી કામગીરીઓ :-

- વિજ્ઞલન્સ ખાતાની એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગની તમામ વહીવટી કામગીરી
- વિજ્ઞલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજ્ઞલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ ના આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિષ્ણયાર્થે મૂકવાની કામગીરી.

ભ્યુનિ.કોપોરેશનના એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાઓ દ્વારા થતી કામગીરીઓની દેખરેખ રાખવા, ભ્યુનિ.કોપોરેશનની હદમાં થતા ગેરકાયદે બાંધકામો/દબાણો દૂર કરાવવા તથા એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાના ટેકનીકલ કર્મચારીઓ વિરુદ્ધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં આસી ભ્યુનિ.કમિશનર(વિજ્ઞલન્સ), આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ. ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ઇન્સ્પેક્ટર/સબ ઇન્સ્પેક્ટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.)મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષ્ણયાર્થે મૂકવામાં આવે છે.

## અ. જનરલ વિભાગ:

### ૦૧. ડાયરેક્ટર(વિજીલન્સ) :-

- ખુનિ.કમિશનરશ્રી,ડે.ખુનિ.કમિશનર(વિજીલન્સ)તેમજ દરેક ઝોનના ડે.ખુનિ.કમિશનરશ્રી તરફથી સોંપવામાં આવતી ફરીયાદોની પ્રાથમીક તપાસ કરવાની તેમજ નાગરીકો તરફથી આવતી ફરીયાદોનો તાકીદ નિકાલ કરવાની કામગીરી મેનેજરશ્રી દ્વારા કરવામાં આવે છે.
- **વિજીલન્સ ખાતાની તમામ વહીવટી કામગીરી**
- વર્ગ-૦૧-૨ ના અધિકારીઓને N.O.C.આપવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગ, અને ઈલેક્ટ્રીકલ એન્ડ મીકેનિકલ તેમજ (ઇજનેર) વિભાગના અધિકારીઓ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગના આસી.મેનેજરો,વિજીલન્સ ઓફિસરો અને આસી.વિજીલન્સ ઓફિસરોને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મુકવાની કામગીરી.

### ૦ ૨. આસી.મેનેજર :-

- આસી.મેનેજરશ્રી દ્વારા તેઓને સોપવામાં આવેલ ખાતાઓની બ્રાચાયાર, ગેરરીતી, તેમજ બેદરકારીની આવતી ફરીયાદોનો યોગ્ય તપાસ કરી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ ડેયુટી ખુનિસિપલ કમિશનરશ્રી (વિજીલન્સ)ની સુચના મળ્યેથી જુદા જુદા ખાતાઓના સ્ટાફની હાજરી ચેકીંગની કામગીરી કરવામાં આવે છે.
- આસી.મેનેજરશ્રી દ્વારા તેઓના તાબા હેઠળ કામ કરતા તમામ સ્ટાફનું સંચાલન તથા માર્ગદર્શનની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત તેમને સોપવામાં આવેલ ખાતાઓ અંગે આવતી આર.ટી.આઈ.અરજીઓનો જરૂરી માહીતી આપી નિકાલ કરવામાં આવે છે.
- તદ્વારા વખતો વખત ખુનિ.કમિશનરશ્રી તથા ડે.ખુનિ.કમિશનરશ્રીઓ તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

### ૦૩. વિજીલન્સ ઓફિસર (જનરલ):-

- સક્ષમ સત્તા દ્વારા વિજીલન્સ ખાતે મોકલવામાં આવતી ફરીયાદો બાબતે આસી.મેનેજરશ્રીની સીધી દેખરેખ હેઠળ સ્થળ તપાસ કરી ચેકીંગ કરી સાચી હકીકતોનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- ખુનિસિપલ કોપોરેશનના વહીવટી ખાતાઓનાં અધિકારી/કમચારીઓ વિરુદ્ધ આવેલ ફરીયાદોની પ્રાથમિક તપાસ કરી તેનો હકીકતલક્ષી રિપોર્ટ આસી.મેનેજરશ્રી દ્વારા સક્ષમ સત્તાને કરવો.
- ઉપરાંત ઉપરી અધિકારીશ્રીઓ તરફથી વખતો વખત સોંપવામાં આવે તે કામગીરી વિજીલન્સ-ઓફિસર (જનરલ) દ્વારા કરવામાં આવે છે.

#### ૦૪. આસી.વિજિલન્સ ઓફિસર (જનરલ) :-

- તમામ જોનનાં વહીવટી ખાતાઓના અધિકારી/કર્મચારીઓ સામે થયેલ ભષાચાર અને ગેરરીતીઓને લગતી થયેલ ફરીયાદોની તપાસ કરી નિકાલ કરવો તથા સ્ટાફનું હાજરી ચેકીંગ કરવું.
- ખુનિ. જનરલ હોસ્પિટલો તથા કોપેરિશન સંચાલીત તમામ દવાખાનાઓને લગતી ફરીયાદોમાં પ્રાથમીક તપાસ કરી સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- તદ્વિપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૦૫. સીનીયર કલાર્ક:-

- ખાતાને લગતી વહીવટી, નાણાંકીય, તેમજ કન્ટીજન્સી વગેરેને લગતી બાબતોની કામગીરી ઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે. એન.ઓ.સી.આપવાની કામગીરી, આસી.મેનેજરશ્રીઓ તથા તમામ વિજિલન્સ ઓફિસરશ્રીઓ તરફથી તૈયાર કરવામાં આવતાં રિપોર્ટસ, પત્ર વ્યવહાર, ટાઈપ કરવાની કામગીરી તેમજ તે બાબતે રિપોર્ટસની ગુપ્તતા જાળવવી.

#### ૦૬. જુનીયર કલાર્ક:-

- ખાતાને લગતી વહીવટી, નાણાંકીય, તેમજ કન્ટીજન્સી તથા આર.ટી.આઈ. વિગેરેને લગતી બાબતોની કામગીરી ઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે. ઈન્વર્ક/આઉટવર્ક, બિલકલાર્કની કામગીરી, રેકર્ડ ક્રીપીગની કામગીરી

#### ૦૭. સેનેટરી સબ-ઇન્સ્પેક્ટરઃ :- (હાલમાં જગા ખાલી)

- તમામ હેલ્થ મસ્ટર સ્ટેશનોનું હાજરી ચેકીંગ તથા ઉપરી અધિકારીશ્રી તરફથી હેલ્થ ખાતાને લગતી વખતો વખત સોંપવામાં આવતી ફરીયાદોની તપાસ કરી સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.

#### ૦૮. ટાઈપીસ્ટ-કમ-કલાર્ક:- (હાલમાં જગા ખાલી)

- આસી.મેનેજરશ્રીઓ તથા તમામ વિજિલન્સ ઓફિસરશ્રીઓ તરફથી તૈયાર કરવામાં આવતાં રિપોર્ટસ, પત્ર વ્યવહાર, ટાઈપ કરવાની કામગીરી તેમજ તે બાબતે રિપોર્ટસની ગુપ્તતા જાળવવી.
- તદ્વિપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવામાં આવે છે.

#### ૦૯. સ્ટેનો :-(હાલમાં જગા ખાલી છે)

#### ૧૦. સર્વેબોય / પટાવાળા:-

- ખાતાની ટપાલ અન્ય ખાતે પહોંચાડવાની કામગીરી ઉપરાંત ખાતાના અધિકારી/કર્મચારી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૧૧. વિજિલન્સ ઓફિસર (લાઈટ -ઇન્ડએન્ડએમ):- (હાલમાં જગા ખાલી)

## બ. ટેકનીકલ વિભાગ:-

### ૦૧. એરીશનલ સીટી એન્જનીયર (વિજ્ઞલન્સ) :-

- ખુનિ.કોપોરિશનના ઈજનેર વિભાગ દ્વારા થતી ટેકનીકલ કામગીરી તથા જુદા જુદા પ્રોજેક્ટોની ટેકનીકલ કામગીરીની દેખરેખ રાખવા તેમજ આ કામગીરી સંદર્ભે આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં ૦૧ ડેપ્યુટી સીટી એન્જનીયર તથા ૦૧ આસી.સીટી.એન્જી (ટેકનીકલ)ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ડે.ખુનિ.કમિશર (વિજ્ઞલન્સ) મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થ મૂકવામાં આવે છે.

### ૦૨. આસી.સીટી.એન્જી.(ટેકનીકલ ):-

- ખુનિ.કોપોરિશનની ટેકનીકલ કામગીરી સાથે સંકળાયેલ ખાતાઓની તપાસ ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- ઈજનેર ખાતાની કામગીરી માટે ખુનિ.કોપોરિશનનાં ૪ ઝોન તથા પ્રોજેક્ટ માટે ૦૨ આસી.સીટી.એન્જી.શ્રી(ટેક)ની નિમણૂંક કરવામાં આવેલ છે.તેઓશ્રી દ્વારા ખુનિ.કોપોરિશન દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ,બીલીંગ,રોડ-રસ્તા,પાણી અને ગટરને લગતા નાગરીક સુવિધાના કામોનું ચેકીગ તથા આવેલ ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવે છે.ઈજનેર ખાતાના તમામ સ્ટાફનું હાજરી ચેકીગ કરવાની કામગીરી.
- રોડ પ્રોજેક્ટ,બ્રીજ પ્રોજેક્ટ,ડ્રેનેજ પ્રોજેક્ટ,વોટર પ્રોજેક્ટ,હાઉસિંગ હોટ મીલ્સ પ્લાન્ટ, એન.આર.સી.પી. એસ.એન.પી. વગેરે કામના મોનીટરીંગ તથા કવોલીટી ચેકીગ તેમજ દરેક ઝોનમાં ટેન્ડરથી કરાવાતા કામોનું ગુણવત્તાનું ચેકીગ કરી તે અંગેના રિપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ મૂકવાની કામગીરી.

### ૦૩. ટેકનીકલ સુપરવાઈઝર:-

- આસી.સીટી.એન્જી. (ટેક)શ્રીના મદદનીશ તરીકેની તથા તેઓશ્રી તરફથી વખતો વખત સોંપવામાં આવતી કામગીરી અંગેનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- તદૃપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

## ક. એસ્ટેટ/ટી.ડી.ઓ.વિભાગ:-

- એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાની કામગીરી માટે આસી.ભૂનિ.કમિશનર(વિજીલન્સ)તથા આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) સબ ઈન્સ્પેક્ટર(એસ્ટેટ-ટી.ડી.ઓ.) નિમણુંક કરવામાં આવેલ છે, જેઓ ભૂનિ. કોપોરિશનની હદમાં થતાં ગેરકાયદેસર બાંધકામ તથા દબાજોને લગતી આવેલ ફરીયાદોનો નિકાલ કરવાની કામગીરી કરે છે. એસ્ટેટ-ટી.ડી.ઓ.ખાતાના તમામ સ્ટાફનું હાજરી ચેકીગ કરવાની કામગીરી.

### ૦૧.આસી.ભૂનિ.કમિશનર(વિજીલન્સ એસ્ટેટ-ટી.ડી.ઓ.)

- ભૂનિ.કમિશનરશ્રી,ડે.ભૂનિ.કમિશનર(વિજીલન્સ)તેમજ દરેક જોનના ડે.ભૂનિ.કમિશનરશ્રી તરફથી સોંપવામાં આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તેમજ નાગરીકો તરફથી આવતી ફરીયાદોનો તાકીદ નિકાલ કરવાની કામગીરી મેનેજરશ્રી દ્વારા કરવામાં આવે છે.
- વિજીલન્સ ખાતા (એસ્ટેટ-ટી.ડી.ઓ.)ની તમામ વહીવટી કામગીરી
- વિજીલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ ના આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ,ઇન્સ્પેક્ટર,સબ ઇન્સ્પેક્ટરને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિષ્ઠિયાર્થે મુકવાની કામગીરી.

### ૦૨.આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર (વિજીલન્સ એસ્ટેટ-ટી.ડી.ઓ.)

- સક્ષમ સત્તા દ્વારા વિજીલન્સ ખાતે મોકલવામાં આવતી ફરીયાદો બાબતે આસી.ભૂનિ.કમિશનરશ્રી(વિજીલન્સ) ની સીધી દેખરેખ હેઠળ સ્થળ તપાસ કરી ચેકીગ કરી સાચી હકીકતોનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- ભૂનિસિપલ કોપોરિશનના એસ્ટેટ-ટી.ડી.ઓ.ઓનાં અધિકારી / કર્મચારીઓ વિરુધ આવેલ ફરીયાદોની પ્રાથમિક તપાસ કરી તેનો હકીકતલક્ષી રિપોર્ટ આસી.ભૂનિ.કમિશનરશ્રી(વિજીલન્સ)દ્વારા સક્ષમ સત્તાને કરવો.
- ઉપરાંત ઉપરી અધિકારીશ્રીઓ તરફથી વખતો વખત સોંપવામાં આવે તે કામગીરી આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે.

### ૦૩.ઇન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) :-

- આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.શ્રીના મદદનીશ તરીકે તથા એસ્ટેટ-ટી.ડી.ઓ.ખાતેથી ગેરકાયદેસર બાંધકામ, દબાજ અને અધિકારી / કર્મચારી વિરુધમાં આવતી તમામ ફરીયાદની તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવો.

**૦૪.સબ-ઇન્સ્પેક્ટર :- (એસ્ટેટ-ટી.ડી.ઓ.) :-**

- આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.અને ઇન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) ના મદદનીશ તરીકે તથા તેઓશી તરફથી વખતો વખત સોપવામાં આવતી કામગીરી કરવી.
- વિજ્ઞલન્સ વિભાગ (એસ્ટેટ-ટી.ડી.ઓ.) માં આવતી અરજીઓ ની નોંધણી કરવી, તપાસ રજીસ્ટર મેઈન્ટેઇન કરવુ, ફાઈલોની જાળવણી અને નોંધણી મેઈન્ટેઇન કરવી.

## ૨. દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહીત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી :-

- વિજ્ઞલન્સ ખાતા દ્વારા અમદાવાદ મ્યુનિ.કોપોરિશન હસ્તકના તમામ ખાતાઓમાં વહીવટી કામગીરી ઉપર સતત ચેકીંગ તથા હાજરી ચેકીંગ અંગેની દેખરેખ રાખવામાં આવે છે. તેમજ કોઈપણ ખાતાના જવાબદાર અધિકારી / કર્મચારી વિરુદ્ધ આવેલ ફરીયાદમાં તપાસ કરી તથા જરૂર જણાયે સ્થળ તપાસ અંગેના રીપોર્ટો મેળવી વિજ્ઞલન્સ તપાસ અંગેનો સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને તે અહેવાલ તે. મ્યુનિ.કમિશનર સાહેબ (વિજ્ઞલન્સ) તરફ યોગ્ય હુકમ અર્થે મોકલવામાં આવે છે. સમગ્ર તપાસ અંગેનો નિર્ણય તે. મ્યુનિ.કમિશનર સાહેબ (વિજ્ઞલન્સ) દ્વારા લેવામાં આવે છે અને કલાસ- ૧, ૨ કક્ષાના અધિકારીના કેશમાં મે. મ્યુનિ.કમિશનર સાહેબની મંજુરી મેળવી અને જો અધિકારી / કર્મચારી જવાબદાર જણાય તો શોકોઝ નોટીસ, ખાતાકીય તપાસની કાર્યવાહી અંગે યોગ્ય હુકમ મેળવવામાં આવે છે. અને ત્યાર બાદ આગળની કાર્યવાહી અર્થે રીપોર્ટ સાથે ફાઈલ અમદાવાદ મ્યુનિ.કોપોરિશનના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે.

## ૩. વિજ્ઞલન્સ ખાતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો :-

- વિજ્ઞલન્સ ખાતા દ્વારા કાર્યો બજાવવા અંગે અમદાવાદ મ્યુનિ.કોપોરિશનના વહીવટની ગેરરીતીઓ અંગે, લાંચ રૂશ્યત અંગે, મ્યુનિ.કોપોરિશનના રૂલ્સ, બાયલોઝ કે નિતિ નિયમો વિરુદ્ધ થયેલ કોઈ ગેર કાયદેસર કામગીરી બાબત, જાહેર જનતાની આવતી ફરીયાદો, વિગેરે બાબતો અંગે પ્રાથમીક તપાસ કરવાની હોય છે. જ્યાં આ પ્રકારની ગેરરીતીઓ કે અનિયમિતતા થયેલી અગર થતી માલુમ પડે ત્યાં પ્રાથમીક તપાસ પુર્ણ કરી રિપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ રજુ કરવામાં આવે છે. તદ્વારાંત વિજ્ઞલન્સ ખાતા દ્વારા ઈજનેર તથા ટી.ડી.ઓ. ખાતાને લગતી તેમજ ટેકનીકલ પ્રકારની ફરીયાદોની તપાસ આ વિભાગના વિજ્ઞલન્સ ઓફિસર (ટેકનીકલ) દ્વારા કરવામાં આવે છે. ઈજનેર ખાતાના કર્મચારીઓનું હાજરી ચેકીંગ તેમજ સ્ટોર, સબસ્ટોર, હોટમીક્ષ પ્લાન્ટનું ચેકીંગ તથા ગેરકાયદેસર પાણી તેમજ ગાટર કનેક્શનના કેસ બાબતે અને ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પગલાં લેવાતા ન હોય અથવા વિલંબ કરવામાં આવતો હોય તો તેની ફરીયાદો અંગેની તપાસ કરી તે બાબતે રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ મુકવામાં આવે છે અને સક્ષમ સત્તાનો હુકમ મેળવી જવાબદાર અધિકારી / કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.

## ૪. પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.

- મ્યુનિસિપલ કોપોરિશનના નિતિ નિયમો તથા ધી બોઝે પ્રોવીન્સીયલ મ્યુ.કોર્પો.એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

## ૫. પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક :-

- અમદાવાદ મ્યુનિસિપલ કોપોરિશન દ્વારા વખતો વખત અમલમાં આવતા નીતિ નિયમ અનુસાર દસ્તાવેજો જાળવવામાં આવે છે.

## ૬. તેની નિતિ અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ ગોઠવણની વિગતો :-

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

૭. તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ? અથવા તેવી બેઠકોની કાર્ય નોંધ લોકોને મળવા પાત્ર છે કે કેમ?

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
૮. વિજ્ઞલન્સ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની માહીતી પુસ્તીકા

અ.નં.	હોદ્દો	શીડયુલ મુજબ મંજૂર થયેલ જગ્યાઓ	ભરાયેલ જગ્યાઓ	ભરાયેલ જગ્યાઓ પૈકી અન્યખાતે ફાળવણી	ખાલી જગ્યાઓ	વિજ્ઞલન્સ ખાતે ફાળવણી થી ફરજ બજાવતા
૧.	ડાયરેક્ટર(વિજ્ઞલન્સ)	૦	૦	૦	૦	૧
૨.	ડે.ડાયરેક્ટર(વિજ્ઞલન્સ)	૧	૧	૧	૦	૦
૩.	એડી.સીટી.એન્જનીયર	૦	૦	૦	૦	૧
૪.	આસી.સીટી.એન્જનીયર.	૬	૦	૦	૬	૩
૫.	આસી.સીટી.એન્જ. (ઈ એન્ડ એમ.)	૧	૦	૦	૧	૦
૬.	આસી.એન્જનીયર	૦	૦	૦	૦	૧
૭.	ટેકનીકલ સુપરવાઈઝર	૦	૦	૦	૦	૨
૮.	આસી.ટી.ડી.ઓ.	૧	૦	૦	૧	૦
૯.	આસી.મેનેજર	૨	૧	૦	૧	૦
૧૦	વિજ્ઞલન્સ ઓફીસર (જનરલ) ઓ.એસ.	૪	૨	૧	૨	૨
૧૧	આસી.વિજ્ઞલન્સ ઓફીસર (જનરલ) હેડ કલાર્ક / સહાયક હેડ કલાર્ક	૧૪	૩	૨	૧૧	૦
૧૨	આસી.વિજ્ઞલન્સ ઓફીસર / ઈન્સ્પેક્ટર	૦	૦	૦	૦	૧

૧૩	એસ્ટેટ-ટી.ડી.ઓ.સબ ઇન્સ્પેક્ટર	૧	૧	૦	૦	૨
૧૪	સીની.કલાર્ક / સહાયક સીની. કલાર્ક	૩	૩	૦	૦	૧
૧૫	જુની.કલાર્ક	૪	૩	૨	૧	૪
૧૬	જુની.કલાર્ક (કંડકર)	૦	૦	૦	૦	૨
૧૭	સ્ટેનોગ્રાફર	૧	૦	૦	૧	૦
૧૮	ટાઈપીસ્ટ	૧	૦	૦	૧	૦
૧૯	સર્વે બોય	૧	૦	૦	૧	૧
૨૦	પટાવાળા	૪	૧	૦	૩	૦
૨૧	હેલ્પર	૦	૦	૦	૦	૫
	કુલ :-	૪૪	૧૫	૬	૨૮	૨૬

૬. તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.:-

અનુ નં.	હોદ્દો	પે-બેન્ડ
૧.	૩.ડાયરેક્ટર (વિજીલન્સ)	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૨.	ટેચ્યુટી સીટી એન્જી.	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૩.	આસી.મેનેજર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૪.	આસી.સીટી.ઇજનેર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૫.	આસી.ટી.ડી.ઓ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૬.	વી.ઓ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૭.	ઇન્સ્પેક્ટર	૪૪૮૦૦-૧૪૨૪૦૦
૮.	સબ ઇન્સ્પેક્ટર	૩૮૮૦૦-૧૨૬૬૦૦
૯.	આસી.વિજ.ઓફીસર	૩૫૪૦૦-૧૧૨૪૦૦
૧૦.	સીની.કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૧.	જુની.કલાર્ક	૧૮૮૦૦-૬૩૨૦૦
૧૨.	પટાવાળા	૧૪૮૦૦-૪૭૧૦૦

૧૦. તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતું તેની દરેક એજન્સીઓ ફાળવેલ અંદાજ પત્ર.

વિજીલન્સ ડિપાર્ટમેન્ટ-કોમ્પ્યુટર કોડ-૧૨૦

સને. ૨૦૨૨-૨૩(અંદાજીત) ના બજેટમાં વિજીલન્સ ડિપાર્ટમેન્ટન અંદાજેલ ખર્ચ.

અ.નં.	વિગત	અંદાજેલ ખર્ચ (રૂ.લાખમાં)
૧.	પગાર ખર્ચ	૧૭૦.૦૦
૨.	યુનિફોર્મ	૦.૨૦
૩.	ટેલીફોન તથા ટ્રેકકોલ (ઓફીસ)	૦.૫૦
૪.	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૪૦
૫.	ઇન્સ્પેક્શન-સેમ્પલ ટેસ્ટીંગ ચાર્જ	૧.૦૦
૬.	સ્ટેશનરી	૦.૭૦
૭.	પ્રિન્ટીંગ	૦.૧૫
૮.	અન્ય ખર્ચ	૧.૭૦
૯.	વાહનખર્ચ	૩.૦૦
૧૦.	પેટ્રોલ/ડીજલ	૨૦.૦૦
કુલ :-		૧૮૭.૬૫

૧૧. ફાળવેલ રકમો, અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહીત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત.
- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
૧૨. તેણે આપેલ છૂટ છાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.
- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
૧૩. ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહીતીને લગતી વિગતો.
- અત્રેના વિભાગની ફાઈલોમાં જેમાં ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં માહીતી ઉપલબ્ધ હોય તે જે તે સ્વરૂપમાં નિયત નિયમાનુસાર ફી ભરી મેળવી શકાય.
૧૪. જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહીતની માહીતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.
- આ વિભાગમાં કોઈ ગ્રંથાલય નથી.

**૧૫. જહેર માહિતી અધિકારીઓના નામો,હોદ્દાઓ અને બીજી વિગતો.**

૧. શ્રી હેમલબેન બી. ભાવસાર  
જહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજી.જનરલ.)  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૪,
- ૨ શ્રી પ્રકૃતલભાઈ બી.ભરવાડ  
જહેર માહિતી અધિકારી અને આસી.સીટી.એન્જી. (ટેકનીકલ)  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૪૨૯
- ૩ શ્રી ભીખાભાઈ એચ. પટેલ  
જહેર માહિતી અધિકારી અને આસી.એ.ઓ./આસી.ટી.ડી.ઓ. (એસ્ટેટ/ટી.ડી.ઓ.)  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૧

**અપીલ અધિકારીશ્રીના નામ તથા હોદ્દાઓ :-**

- ૧ શ્રી હીના એસ. ભાથાવાલા  
અપીલ અધિકારી અને ડાયરેક્ટર/ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (વિજીલન્સ),  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૮૯૮૮/૬૫૮
- ૨ શ્રી નેનેશ બી. દોશી  
અપીલ અધિકારી અને એડી.સીટી.ઇજનેર (વિજીલન્સ ટેકનીકલ),  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૮/૪૨૯
- ૩ શ્રી હિતેષકુમાર એન. ગજજર  
અપીલ અધિકારી અને આસી.મ્યુ.કમિશનર (વિજીલન્સ એસ્ટેટ/ટી.ડી.ઓ.),  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૮/૪૨૯

૧૬. ઠરાવવામાં આવે તેવી બીજી માહીતી :-

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

**અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન**  
**મહાનગર સેવા સંદર્ભ**  
**વિજીવલન્સ ખાતું**  
સરનામું : સરદાર પટેલ ભવન, " સી " બ્લોક, પહેલોમાળ, દાઢાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧  
ટે.નં. : ૨૫૭૮૧૮૧૧ એક્સ નં.૬૫૮ તથા ૨૮૮૧૧૮૬, ઈ-મેઈલ [vigilance@egovamc.com](mailto:vigilance@egovamc.com)

---

તા. ૦૬/૦૬/૨૦૨૨

જીએર માહીતી અધિકારી  
આર.ટી.આઈ.સેલ,  
અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ.

વિષય:- માહીતી અધિકાર અધિનિયમકલમ-૪(ભ) મુજબ વિજીવલન્સ ખાતાનો  
પ્રો-એક્ટીવ ડીસ્કલોગર અધતન કરી મોકલવા બાબત.

ઉપરોક્ત વિષયના અનુસંધાને વિજીવલન્સ ખાતાની માહીતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ ૪(૧)  
બી(૧) મુજબ વિજીવલન્સ ખાતાનો (પ્રોએક્ટીવ ડીસ્કલોગર) નિયત ફોર્મેટમાં તૈયાર કરી અને અધતન કરી પુસ્તિકા  
સ્વરૂપે આ સાથે મોકલી આપેલ છે. જેનું પ્રમાણપત્ર નીચે મુજબ સામેલ છે.

ડાયરેક્ટર ( વિજીવલન્સ)

## પ્રમાણપત્ર

આશી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી (પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહીતી અધિકાર અધિનિયમની કલમ નં.૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો “(પ્રોએક્ટીવ ડિસ્કલોઝર) ” (PAD) તૈયાર કરવામાં આવી છે અને તા.૦૧/૦૫/૨૦૨૨ ની સ્થિતિએ તે અધતન કરવામાં આવેલ છે

તા.૦૧/૦૫/૨૦૨૨ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડિસ્કલોઝર (PAD) નું ઇન્સ્પેક્શન-કમ-ઓડીટ બાકી રહેલ નથી.

આસી મેનેજર

ડાયરેક્ટર  
(વિજ્ઞલન્સ)



## અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સંદર્ભ

વિજીવન્સ ખાતુ



સરનામું : સરદાર પટેલ ભવન, “સી” બ્લોક, પહેલોમાળી, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧

ટે.નં. : ૨૫૩૮૧૮૧૧ એક્સ નં.૬૫૮ તથા ૦૨૭૮૧૧૮૬, ઈ-મેઈલ [vigilance@egovamc.com](mailto:vigilance@egovamc.com)

તા. ૦૬/૦૬/૨૦૨૨

મે.ટેચ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજીવન્સ) સાહેબ,

વિષય:- વિજીવન્સ ખાતાની માહીતી મોકલવા બાબત.

સંદર્ભ:- ૧. આર.ટી.આઈ.સેલ વિભાગ (આર.ટી.આઈ.સરક્યુલરનં ૧ વર્ષ-૨૦૨૨/૨૩)

અન્વયે

ઉપરોક્ત વિષયના અનુસંધાને વિજીવન્સ ખાતાની માહીતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ ૪(૧) (ખ) મુજબની માહીતી મોકલી વેબસાઈટ ઉપર મુકવાની હોવાથી વિજીવન્સ ખાતાનું પ્રોએક્ટીવ ડીસ્કલોઝર પુસ્તિકા સ્વરૂપે તૈયાર કરેલ છે. જે આર.ટી.આઈ.સેલ, અમદાવાદ મહાનગર સેવાસંદર્ભ ખાતે મોકલી આપવા આપ સાહેબની મંજુરી આપવા વિનંતી છે.

આસી મેનેજર

ડાયરેક્ટર

(વિજીવન્સ)

ટેચ્યુટી મ્યુનિસિપલ કમિશનર

(વિજીવન્સ)



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સંદર્ભ

વિજલન્સ ખાતુ



સરનામું : સરદાર પટેલ ભવન, " સી " બ્લોક, પહેલોમાળ, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧

ટે.નં. : ૨૫૩૮૧૮૧૧ એક્સ નં.૬૫૮ તથા ૩૨૮૧૧૮૬, ઈ-મેઈલ vigilance@egovamc.com

તા. ૦૯/૦૯/૨૦૨૨

પ્રતિ,  
મેનેજરશ્રી  
ઈ.ડી.પી.ડિપાર્ટમેન્ટ.

વિષય:- માહીતી અધિકાર અધિનિયમકલમ-૪(ખ) મુજબ વિજલન્સ ખાતાનો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર અધતન કરી મોકલવા બાબત.

સંદર્ભ:- આર.ટી.આઈ.સેલવિભાગ(આર.ટી.આઈ.સરકુલરનં ૧ વર્ષ-૨૦૨૨/૨૩)  
અન્વયે

ઉપરોક્ત વિષયના અનુસંધાને વિજલન્સ ખાતાની માહીતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ ૪(૧)  
બી(૧) મુજબ વિજલન્સ ખાતાનો (પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર) સોફ્ટ કોપીમાં તૈયાર કરી આ સાથે મોકલી આપેલ છે. જે  
ઉસ્માનપુરા ખાતેના મેઈન સર્વરમાં અધતન કરાવવા યોગ્ય થવા વિનંતી છે.

ડાયરેક્ટર (વિજલન્સ)

